

7

નિર્દર્શન-પદ્ધતિઓ

(Sampling Methods)

પ્રકરણ 1માં આપણે જોયું કે, સમાચાર એકમોમાંથી પસંદ કરેલ એકમોના સમૂહને નિર્દર્શન કહે છે. નિર્દર્શન પસંદ કરવાની પ્રક્રિયાને નિર્દર્શન કહેવાય છે. સમાચારનો અને તેના પ્રાચલોનો અભ્યાસ કરવા માટે નિર્દર્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આપેલ માહિતીને અનુરૂપ નિર્દર્શનની જુદી-જુદી પદ્ધતિઓ અને તેના દ્વારા નિર્દર્શન પસંદ કરવાનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરેલ છે.

વિભાગ A

નીચે આપેલ બહુવિકલ્પ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ જે-તે પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો :

1. અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને શું કહે છે ?

- (a) સમાચાર તપાસ (b) નિર્દર્શન તપાસ (c) સમાચાર (d) નિર્દર્શન

2. સમાચાર પ્રતિનિધિત્વ માટે પસંદ કરેલા એકમોના સમૂહને શું કહે છે ?

- (a) નિર્દર્શન (b) નિર્દર્શન (c) સમાચાર તપાસ (d) નિર્દર્શન તપાસ

3. ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તીગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે ?

- (a) સમાચાર તપાસ (b) નિર્દર્શન તપાસ (c) પરોક્ષ તપાસ (d) પદ્ધિક તપાસ

4. કોઈ વ્યક્તિના જ્લડગૂપની જાણકારી માટે લીધેલ લોહીના નમૂનાની તપાસ એ કઈ તપાસનું ઉદાહરણ છે ?

- (a) સમાચાર તપાસ (b) નિર્દર્શન તપાસ (c) પરોક્ષ તપાસ (d) પદ્ધિક તપાસ

5. જ્યારે સમાણ હોય ત્યારે કઈ નિર્દર્શન-પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?

(a) સરળ યાદચિક નિર્દર્શન-પદ્ધતિ

(b) પદિક નિર્દર્શન-પદ્ધતિ

(c) સ્તરિત યાદચિક નિર્દર્શન-પદ્ધતિ

(d) ગુચ્છ નિર્દર્શન-પદ્ધતિ

6. સરળ યાદચિક નિર્દર્શન પસંદ કરવાની વૈજ્ઞાનિક રીત કઈ છે ?

(a) લોટરીની રીત

(b) યાદચિક સંખ્યાનાં કોષ્ટકોની રીત

(c) પદિક નિર્દર્શનની રીત

(d) સ્તરિત નિર્દર્શનની રીત

7. જ્યારે સમાણ વિષમાંગ હોય ત્યારે કઈ નિર્દર્શન-પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ?

(a) સરળ યાદચિક નિર્દર્શન-પદ્ધતિ

(b) સ્તરિત યાદચિક નિર્દર્શન-પદ્ધતિ

(c) પદિક નિર્દર્શન-પદ્ધતિ

(d) દ્વિત્બક્કીય નિર્દર્શન-પદ્ધતિ

8. ક્યો નિર્દર્શ એ સંપૂર્ણપણે યાદચિક નિર્દર્શ નથી ?

(a) સરળ નિર્દર્શ

(b) સ્તરિત નિર્દર્શ

(c) પદિક નિર્દર્શ

(d) ગુચ્છ નિર્દર્શ

9. પ્રથમિત સંકેત અનુસાર પદિક નિર્દર્શન માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ યોગ્ય છે ?

(a) $N = nk$

(b) $n = Nk$

(c) $k = Nn$

(d) $N = \frac{k}{n}$

10. એક સમાણમાં 100 એકમો છે. 20 એકમોનો પદિક નિર્દર્શ લેવા માટેનો નિર્દર્શ અંતરાલ જણાવો.

(a) 5

(b) 10

(c) 15

(d) 20

11. એક સમાણમાં 30 એકમો છે. જો પદિક નિર્દર્શન માટે અંતરાલ 5 હોય, તો નિર્દર્શનું કદ જણાવો.

(a) 5

(b) 6

(c) 15

(d) 30

વિભાગ B

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં (જરૂર હોય ત્યાં ગણતરી કરીને) જવાબ લખો :

1. નિર્દર્શન-પદ્ધતિનાં નામ લખો.

2. નિર્દર્શન એટલે શું ?
3. નિર્દર્શ તપાસ એટલે શું ?
4. પુરવણી સહિત નિર્દર્શન એટલે શું ?
5. કયા સંજોગોમાં મોટા કદનું નિર્દર્શ પસંદ કરવામાં આવે છે ?
6. કાયદાકીય અને બંધારણીય જોગવાઈ હેઠળ ફરજિયાત હોય ત્યારે કઈ તપાસ કરવામાં આવે છે ?
7. નિર્દર્શનનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
8. નિર્દર્શ એકમો પરથી ભળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે ?
9. સમાચિના પ્રાચલનું ઉદાહરણ આપો.
10. સરળ યાદચિક નિર્દર્શનમાં સામાન્ય રીતે નિર્દર્શ મેળવવા માટે કઈ-કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે ?

11. લોટરીની રીતમાં પક્ષપાત કે પૂર્વગ્રહ ન રહે તે માટે શી કાળજી લેશો ?
12. યાદચિક સંખ્યાઓનાં પ્રચલિત કોષ્ટકોનાં નામ લખો.
13. સ્તરીકરણ (stratification) એટલે શું ?
14. પ્રત્યેક સ્તર માટે નિર્દર્શનું કદ નક્કી કરવાની રીતો જણાવો.
15. પદ્ધિક નિર્દર્શન એટલે શું ?
16. પદ્ધિક નિર્દર્શનનો ઉપયોગ ક્યારે કરવો હિતાવહ છે ?
17. એક પદ્ધિક નિર્દર્શ માટે નિર્દર્શ અંતરાલ 15 છે. નિર્દર્શમાં 67મો એકમ પસંદ થયો હોય, તો તેની અગાઉ પસંદ થયેલ એકમનો કમ જણાવો.

વિભાગ C

નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો : (જરૂરી હોય ત્યાં ગણતરી કરવી.)

1. કઈ પરિસ્થિતિમાં નિર્દર્શન અનિવાર્ય છે ?

2. આદર્શ નિર્દર્શનાં લક્ષણો લખો.
3. નિર્દર્શનું કદ નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા લખો.
4. સરળ યાદચિક નિર્દર્શન-પદ્ધતિના લાભ અને ગેરલાભ લખો.
5. એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નીચે આપેલ યાદચિક સંખ્યાઓનો ઉપયોગ કરી 5 વિદ્યાર્થીઓનો પુરવણી સહિતનો યાદચિક નિર્દર્શ મેળવો.

03, 47, 43, 73, 86, 36, 96, 47, 36, 41, 25, 33

6. નીચે આપેલી યાદચિક સંખ્યાઓનો ઉપયોગ કરી 100 મોબાઇલ-નંબરોની એક યાદીમાંથી પ્રમોશનલ ઓફર માટે 12 મોબાઇલ-નંબરોનો પુરવણીરહિત યાદચિક નિર્દર્શ મેળવો.

(નોંધ : દરેક સંખ્યાના પ્રથમ બે અંકનો ઉપયોગ કરવો.)

153, 375, 263, 699, 157, 448, 687, 833, 940, 697, 260, 378, 269, 515, 778, 786, 143

7. એક કંપનીમાં 40 કર્મચારીઓ છે. તેમાંથી 5 કદનો પદિક નિર્દર્શ પસંદ કરવાનો છે. નિર્દર્શ કેવી રીતે પસંદ કરશો તે સમજાવો.

વિભાગ D

નીચેના પ્રશ્નોના જવાબ લખો : (જરૂરી હોય ત્યાં ગણતરી કરવી.)

1. સ્તરિત યાદચિક નિર્દર્શનપદ્ધતિના લાભ અને ગેરલાભ લખો.

2. પદિક નિર્દર્શનના લાભ અને ગેરલાભ લખો.

3. નીચે ત્રણ અંકો ધરાવતી યાદચિહ્નક સંઘાઓ આપેલી છે. આ યાદચિહ્નક સંઘાઓનો ઉપયોગ કરીને 500 કદની સમાચિમાંથી 2 % કદનું પુરવણીરહિત અને પુરવણી સહિત યાદચિહ્ન નિર્દર્શ મેળવો.

270, 530, 390, 420, 270, 111, 189, 273, 692, 488, 512, 192, 219, 912, 129, 723

4. એક કલબમાં કેટલાક યુવાનો કિકેટનું કોચિંગ મેળવી રહ્યા છે. તેમાંથી 15થી 25 વર્ષના 60 યુવાનો અને 25થી 35 વર્ષના 40 યુવાનો છે. આ સમાચિમાંથી સ્તરિત યાદચિહ્ન નિર્દર્શન-પદ્ધતિ દ્વારા 15થી 25 વર્ષના 7 અને 25થી 35 વર્ષના 4 યુવાનો પુરવણીરહિત પસંદ થાય તેવો નિર્દર્શ મેળવો.

15થી 25 વર્ષના યુવાનો માટે યાદચિહ્ન સંઘાઓ :

40, 25, 80, 39, 19, 27, 18, 25, 79, 19, 58, 24, 25, 34, 22, 27, 21, 26, 29

25થી 35 વર્ષના યુવાનો માટે યાદચિહ્ન સંઘાઓ :

51, 33, 38, 35, 45, 41, 33, 57, 28, 32, 36, 28

5. 50 કદની સમાયમાંથી 10 કદના શક્ય બધા જ પદિક નિદર્શા મેળવો.
6. એક ફૂટનો વેપારી 40 સફરજનની પેટીમાંથી 10 પેટી તેના સંબંધીઓને મોકલવા માંગે છે, તો પદિક નિદર્શનો ઉપયોગ કરી શક્ય બધા જ નિદર્શા મેળવો.

